




અંક-૩
ખંડ-૧
જાન્યુઆરી ૨૦૧૭



કૃષિ ઉત્પાદન અને બજાર દર્દન

કૃષિ ઉદય...

માઇકોસોફ્ટ અને ઈક્સીસેટે પાક વાવેતર એપ્લિકેશન વિકસાવી કે જેનાથી ૩૦% પાક ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ

માઇકોસોફ્ટ (MICROSOFT) અને અર્ધ-શુષ્ણ ઉષણ કટિબંધિત વિઝાનારો માટેની આંતરરાષ્ટ્રીય પાક સંશોધન સંરક્ષાને (ICRISAT) આંધ્રપ્રદેશ સરકારની સાથે ભાગીદારી કરીને એક પાક વાવણી માટેની એપ્લિકેશન વિકસાવી છે. તેનાથી ખેડૂતોની પાક ઉત્પાદકતામાં પ્રતિ એકરે 30% વધારો થયો છે.

આ એપ્લિકેશન અખતરાના ભાગડુપે કુરુનાલ જિલ્લાના દેવાનાકોડા મંડળમાં જૂન-૨૦૧૭ માં શરૂ કરી હતી. આ એપ્લિકેશન ખાસ કરીને મગફળી પક્વતા નાના ખેડૂતોને વાવણીનો યોગ્ય સમય, જમીનની પ્રત અને અન્ય મહત્વના નિર્દેશકોના માર્ગદર્શન ના આધારે મહત્વમાં ઉત્પાદન મેળવવા માટે વિકસાવી હતી. તેના માટે ગામમાં એક સલાહકાર ડેશબોર્ડ રચવામાં આવી હતી, જે ખેડૂતોને જમીનની ફળદુપતા, રાસાયણિક ખાતરની ભલામણ અને અઠવાડિક આબોહવાના અનુમાનોની આગાહી આપતી હતી.

આ એપ્લિકેશનના અખતરા દરમિયાન નક્કી કરેલ ૧૦ ખેડૂતોને જૂન ૧૦, ૨૦૧૭ થી એસએમએસ (SMS) માર્ક્ષ્ટે તેલુગુ ભાષામાં પાક વિષયક મહત્વની માહિતી જેવી કે જીજની માવજત, જમીનમાં યોગ્ય ઉદાઈએ જીજની વાવણી, આગોતરા નિંદામણની તકેદારી, જમીન તૈયાર કરવી, પાક વાવણી, પાકની



અધ્યક્ષ:
પ્રો. શિવીષ આર. કુલકર્ણી

માનનીય સલાહકાર :
ડૉ. મહેશ પાઠક

મુખ્ય સંપાદક :
ડૉ. એસ. એસ. કલમકર

સહસંપાદક :
ડૉ. એચ. પી. ત્રિવેદી
ડૉ. ડી. ઐ. ચૌહાણ

સંપાદક :
ડૉ. હેમત શર્મા

વિષય સંપાદક :
ડૉ. એસ. આર. બૈયા
ડૉ. વિજય એસ. જરીવાલા
ડૉ. એમ. એન. રવેણ
શ્રી એમ. મહવાણા

પ્રસાર પ્રભારી :
શ્રી દીપ કે. પટેલ

પ્રકાશક :
એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર,
સરદાર પેટેલ યુનિવર્સિટી,
વાલ્સબ વિદ્યાનગર-૩૮૮૧૨૦
આણંદ, ગુજરાત

E-mail: director.aerc@gmail.com
website: www.aercspu.ac.in

સુકવણી અને પાકનો સંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે. આ રીતે એકત્રિત કરેલી આંકડાકીય માહિતીને રૈયતુક કોસમ પ્રોજેક્ટના આંકડાઓ સાથે સંકલન કરીને સમગ્ર મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે.

માઈક્રોઓફ્ટ અને ઈક્સીસેટની સલાહકાર સમિતિએ દર્શાવેલ માર્ગદર્શન મુજબ નોંધાયેલ ખેડૂતોએ જૂનના અંત સુધી પાકની વાવણી કરી હતી. કેટલાંક ખેડૂતોએ પાકની વાવણી જૂનના પ્રથમ અઠવાડિએ કરી હતી, તેઓએ

સોચાબીનની નિકાસમાં ૪૪૯.૩૮ % નો વધારો.....

સોચાબીન પ્રોસેસર્સ એસોક્રિસિએશન (SOPA)એ પ્રકાશિત કરેલ આંકડાઓ મુજબ, ભારતે જાન્યુઆરી, ૨૦૧૭ દરમિયાન સોચાબીન અને તેની મૂલ્યવાર્ધિત ચીજોની નિકાસ ૧.૫૫ લાખ ટનની કરી હતી તેની તુલનાએ જાન્યુઆરી-૨૦૧૫માં આ નિકાસ ૦.૨૮ લાખ ટન હતી. આમ સોચાબીનની નિકાસમાં ૪૪૯.૪%નો વધારો થયો છે. નાણાંકીય વર્ષના આધારે જોઈએ તો એપ્રિલ-૨૦૧૯ થી જાન્યુઆરી-૨૦૧૭માં સોચાબીનની નિકાસ રૂ.૦૧ લાખ ટન થઈ છે. તેની સરખામણીએ આ જ સમયગાળામાં ગયા વર્ષ નિકાસ ૩.૩૧ લાખ ટન થઈ હતી. આમ, આ ગાળા દરમિયાન નિકાસમાં ૮૧.૮%નો વધારો નોંધાયેલ હતો. પ્રવીતમાન તેલ વર્ષ દરમિયાન (ઓક્ટોબર-નવેમ્બર) કુલ

અપૂર્કતી પાકની ઉત્પાદકતા મેળવી હતી કારણ કે ઓગાર્ટ માસમાં વરસાદનો ગાળો ખૂબ જ લાંબો રહ્યો હતો. જ્યારે નોંધાયેલ ખેડૂતોમાંથી જેમણે જૂનના અંતિમ અઠવાડિએ અને જુલાઈના પ્રથમ અઠવાડિએ પાકની વાવણી કરી અને સલાહકારનું માર્ગદર્શન મેળવ્યું હતુ, તેઓએ પાકની ઉત્તમ ઉત્પાદકતા મેળવી હતી. તેમ સી.મધુસુણ (પ્રમુખ, ચૈતન્ય યુવા સંમેલન અને વોટરશેડ કોમ્યુનિટી સંમેલન, દેવાનાકોડા) એ જણાવ્યું હતુ.



નિકાસો ઓક્ટોબર-૨૦૧૯ થી જાન્યુઆરી-૨૦૧૭ દરમિયાન ૫.૨૯ લાખ ટન થઈ છે. તેની સામે ગયા વર્ષ કુલ નિકાસ ૧.૨૮ લાખ ટન હતી જે દર્શાવે છે કે કુલ નિકાસ ૩૦૯.૬ % વધી છે.

બાગાયતી પાકો માટે સરકારે આવક વિમા યોજના અમલમાં મૂકી.....



અને તમાકુના પાક માટે અખતરાના ધોરણે અમલમાં મૂકી છે. આવા પાકો લેતાં ખેડૂતોને પ્રતિકૂળ આબોહવાના પરિણામે મળતી નીચી ઉત્પાદકતા, જંતુઓના ઉપદ્રવોથી થતાં જુકશાન તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા રસાનિક ભાવોમાં થતાં ઘટાડાને કારણે ખેડૂતોને મળતી નીચી આવક વગેરે જેવા જેવડા જોખમોની સામે રક્ષણ આપવા માટે વાણિજ્ય મંત્રાલયે આ યોજનાને

બાગાયતી પાકોની જેતી કરતાં ખેડૂતોને નીચા ભાવોથી થતી ઓછી આવક, જીવંતુથી થતાં જુકશાન અને નીચી ઉત્પાદકતા જેવા જોખમો સામે રક્ષણ આપવા માટે આવા ખેડૂતો માટે આવક વિમા યોજનાની મંજૂરી વાણિજ્ય મંત્રાલયે આપી છે. ભાવ રિથરતા બંડોળ યોજના કે જે ૨૦૦૩માં શરૂ કરવામાં આવી હતી તેને સપ્ટેમ્બર, ૨૦૧૫માં બંધ કરવામાં આવી હતી અને તેની જાયાએ બાગાયતી પાકોની જેતી માટે પાક આવક વિમા યોજનાને સપ્ટેમ્બર, ૨૦૧૯માં મંજૂરી આપવામાં આવી છે.

મંત્રાલયે જણાવતાં કહ્યું છે કે આ યોજનાને ૨ વર્ષ માટે પશ્ચિમ બંગાળ, કેરાલા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આસામ, સિક્કિમ અને તામિલનાડુના આચ જિલ્લાઓમાં ચા, કોણ્ણી, રબર, એલચી અને તમાકુના પાક માટે અખતરાના ધોરણે અમલમાં મૂકી છે. આવા પાકો લેતાં ખેડૂતોને પ્રતિકૂળ આબોહવાના પરિણામે મળતી નીચી ઉત્પાદકતા, જંતુઓના ઉપદ્રવોથી થતાં જુકશાન તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા રસાનિક ભાવોમાં થતાં ઘટાડાને કારણે ખેડૂતોને મળતી નીચી આવક વગેરે જેવા જેવડા જોખમોની સામે રક્ષણ આપવા માટે વાણિજ્ય મંત્રાલયે આ યોજનાને

મંજૂરી આપી છે. અખતરા હેઠળ આ પ્રોજેક્ટના પ્રાપ્ત્ય પરિણામોના આધારે આ યોજનાને બીજા જીતાઓ માટે વિરતારવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું છે.

બટાકાનું મબલખ ઉત્પાદન થવાની ગુજરાતના ખેડૂતોની અપેક્ષા



રાજ્યમાં ગયા વર્ષ બટાકાનું વાવેતર ૧૦.૭૦ લાખ હેક્ટરમાં થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષ વાવેતર ૧૨ લાખ હેક્ટરમાં થવાની સંભવાના છે. બટાકાના વાવેતરમાં ડીસેમ્બર ૨૦૦૫ થી ૨૦૧૫ સુધીમાં પ.૧૮ લાખ હેક્ટર જેટલો વધારો થયો હતો. તેમ છતાં આ વર્ષ આ જ સમયગાળામાં ૧૦.૧૭ લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. પરિણામે જ આ વર્ષ મબલખ બટાકાના ઉત્પાદનની અપેક્ષા સેવાય છે, અત્યારે દેશમાં ગુજરાત રાજ્ય બટાકાના ઉત્પાદનમાં પાંચમું રથાન ઘરાવે છે. રાજ્યમાં બટાકાના ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૧૪ માં ૨૩ લાખ ટન બટાકા બજારમાં આવ્યા હતા, જે ૨૦૧૫ માં ૩૧ લાખ ટન થયા હતાં અને વર્ષ ૨૦૧૬માં તે વધી ૩૫ લાખ ટન થયા હતાં. એક અધિકારીના જણાવ્યા મુજબ આ મહિનાના છેલ્લા ૨૦ દિવસમાં બટાકા હેઠળનો વાવેતર વિરતાર અંદાજે પ.૫૧ લાખ હેક્ટર વધ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ વલણ ચાલુ રહેશે તો ૧૨ લાખ હેક્ટર વિરતારથી પણ વધુ વધારો ગુજરાતમાં થશે જે અત્યાર સુધીમાં સૌથી વધુ હશે.

FAO ની ૨૦૧૬ માં ૭૪૮ મી.ટન ઘઉંના ઉત્પાદનનો અંદાજ

સયુંકત રાષ્ટ્ર સંઘના ખાદ અને કૃષિ સંગઠને (FAO) ૨૦૧૬માં વૈશ્વિક ઘઉંના ઉત્પાદનની આગાહી કરી છે કે ઘઉંનું ઉત્પાદન આ વર્ષ સૌથી વધુ ૭૪૮ મી.ટન થશે. જે ગયા મહીને તેના અંદાજમાં જણાવેલ કે ૭૪૯.૭ મી.ટનથી વધુ રહેશે. આ અંદાજમાં વધારો થવાનું મુખ્ય કારણ ઈરાન અને કાકિઝતાનમાં ઘઉંના ઉત્પાદનમાં સુધારો થયો છે, એમ જણાવવામાં આવ્યું છે. આ માસના સંઘના અહેવાલમાં જણાવ્યું છે કે ગયા વર્ષ ઘઉંનું ઉત્પાદન ૭૩૫ મી.ટન હતું તેના કરતાં આ ઉત્પાદન મહત્વમાં હશે. કુલ ઉત્પાદનમાં વધારો થવાનું મુખ્ય કારણ યુ.એસ, રશિયા અને યુ.કે માં અનુકૂળ વાતાવરણ અને આખોહવા છે. એક્સાંપ્લર્સ એન્સેપ્ટ્સ એવી પણ અપેક્ષા રાખી છે કે આ વર્ષ ભારત અને પાકિઝતાનમાં પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ઘઉંનું ઉત્પાદન વધશે. આ વર્ષ ચીનમાં પણ ઘઉંના પાકના ઉત્પાદનમાં વધારો થશે.



સરકારનો ખેતી ક્ષેત્ર માટે ઈ-હબનો પ્રારંભ

કૃષિ મંત્રાલયે ભારતીય કૃષિ સંશોધન પરિષદે (ICAR) ડેટા સેન્ટર શરૂ કરેલ છે જેમાં ૨૭૪ જેટલી વિશિષ્ટ સંરથાઓ અને યુનિવર્સિટીઓ કે જે કૃષિ ક્ષેત્રની માહિતીના કેન્દ્ર તરીકે કાર્યરત છે અને હાઇ રીટ ઇન્ફોર્નેટ નેટવર્ક સાથે ગ્રામીણ વર્તીને જોડશે. કેન્દ્ર કન્સલ્ટન્સી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, તાલીમ અને અન્ય ઉત્પાદકીય સેવાઓ દ્વારા સંરથાઓને સંશોધન માટે મદદ કરશે. આ ICAR ડેટા સેન્ટર કૃષિ ક્ષેત્રે 'ડિજિટલ ભારત અભિયાન'ના પ્રોત્સાહન માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઝુંબેશનો ઉદ્દેશ ઈલેક્ટ્રોનિક સેવાઓ પૂરી પાડી કાગળની જરૂરિયાતો ઘટાડવાનો ધોય છે તેવું કૃષિ મંત્રીશ્રી રાધા મોહન સિંહે

જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઘણા લોકો અમારા પાક ઉત્પાદન અંગેના આંકડાઓ વિશે શંકા વ્યક્ત કરે છે. તેથી નવું ICAR ડેટા સેન્ટર/માહિતી કેન્દ્ર પારદર્શક અને સચોટ માહિતી પૂર્વી પાડશે. કૃષિ ઉત્પાદનના વેપારીઓ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ ના ઘણું ઉત્પાદન ₹૩.૫૫ મિલિયન ટન અંગે શંકા હતી અને તેઓ આ ઉત્પાદન ૮૫ મિલિયન ટન હોવાનું માને છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જેવી મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી હતી.



#TransformingIndia

Saksham Kisan, Samridh Bharat

KVK Portal: An Online Monitoring System for Farmers

Provisions for online monitoring of KVKs

Weather & Market information available

Ready information on different services

Various training programmes for farmers & youth alike

Farmers & Agricultural Officers can seek information related to KVKs

Information about forthcoming schemes & programmes

District level information on agriculture



MyGovIndia

MyGovIndia

<https://transformingindia.mygov.in>

Published Date: 15th July, 2016

DOI : March- 07, 2017

નુક પોર્ટ

પ્રતિ શ્રી

મોકલનાર:

એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર
ગુજરાત અને રાજ્યાંશન રાજ્યો માટે
(કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર)
એચ. એમ. પટેલ ઇન્ફ્રાટ્રાયર ઓફ ઇન્ડિયા ડેવલપમેન્ટ,
નંદાલય હૈલેની સાગે, પોર્ટ બોર્ડ નંબર ૨૪,
સરદાર પેટેલ યુનિવર્સિટી,
વાલબ વિદ્યાનગર-૩૮૮૧૨૦, આંધ્ર, ગુજરાત
ફોન : +૯૧-૨૭૬૨-૨૩૦૧૦૯, ૨૩૦૭૯૯
ફેક્સ : +૯૧-૨૭૬૨-૨૩૩૧૦૯

Acknowledged the information used/taken from the public domain